

### **Hindustan Oil Exploration Company Limited**

'Lakshmi Chambers', 192, St. Mary's Road, Alwarpet, Chennai - 600 018. INDIA. ©: 91 (044) 66229000 • Fax: 91 (044) 66229011 / 66229012

E-mail: contact@hoec.com • Website: www.hoec.com CIN: L11100GJ1996PLC029880

The Corporate Relationship Department

1st Floor, P. Jeejeebhoy Towers,

June 27, 2019 By Online

The Listing Department
The National Stock Exchange of India Ltd.,

"EXCHANGE PLAZA", Bandra Kurla Complex, Bandra (East), MUMBAI – 400 051

Dalal Street, MUMBAI – 400 001 Stock Code: 500186

**BSE Limited**,

Stock Code: HINDOILEXP

Dear Sirs,

Sub: Newspaper Advertisement for proposed transfer of shares of the Company pursuant to SEBI Circular dated 6<sup>th</sup> November 2018

Pursuant to SEBI Circular No. SEBI/HO/MIRSD/DOS3/CIR/P/2018/139 dated 6<sup>th</sup> November 2018, the Company has issued newspaper advertisements giving notice of proposed transfers of shares of the Company and within 30 days of the said notice, if no objection is received in this regard then the Company will effect the proposed transfers.

Copies of the newspaper advertisements published in Business Line (in English) and Loksatta (in Gujarati) on 27<sup>th</sup> June 2019 for the proposed transfers is attached.

We request you to kindly take the same on records.

Yours Sincerely,

For Hindustan Oil Exploration Company Limited

G Josephin Daisy Company Secretary

Encl.: a/a

# 'Sterlite plant, a target of vested interests'

Vedanta Group says TN govt has chosen to ignore pollution by power plants

The Vedanta Group has denied that the Sterlite copper smelter in Thoothukudi has been a significant contributor to the water and air pollution in the area.

Sterlite has been a target of vested interests, which is evident from the fact that there has been surge in public demonstrations and complaints against the company after its expansion project was announced, the group said in a rejoinder to the counter-affidavit filed by the Tamil Nadu government in the Madras High Court.

The Madras High Court on March 1 admitted a petition filed by the Vedanta Group for re-opening the Sterlite facility, but declined to grant interim

relief that would have given the company access to the plant for maintenance work. A Division Bench comprising Justices TS Sivagnanam and Bhavani Subbaroyan will be hearing the case, which is coming up on Thursday.

The Vedanta Group, in the rejoinder, said that Thoothukudi has power plants with the largest capacity (5,000 MW) in a single city within Tamil Nadu.

Hence, emissions of SOX (sulphur oxides), NOX (oxides of nitrogen), and RSPM (respirable suspended particulate matter) are relatively higher. This has led to huge human development concerns, which has been ignored by the State government even as it targeted the company with its prejudicial



The Vedanta Group claims that agriculture around the Sterlite plant has improved over the last few years

INTERVIEW

actions. The SO<sub>2</sub> (sulphur dioxide) emissions from its copper smelter are not more than 1-2 per cent of the total SO<sub>2</sub> emissions in Thoothukudi. It has denied that the significant pollutant marker levels have gone down after the closure of the

There are conclusive evidences on the impact due to power plants, but the State government has chosen not to mention any of it for oblique reasons, Vedanta said.

'Data not considered'

The data collected from the region surrounding the plant area show that agriculture has improved in the Ottapidaram taluk over the last few years, with the net sown area increasing from 29,030 hectares in 2003-04 to 36,315 hectares in 2009-10. The ground water in and around the unit has always had high levels of total dissolved solids, chlorides, sulphates and total hardness due to the site's proximity to coastal aquifers. Hence, even before the copper smelter was set up, the water was unfit for domestic use

The company has complied with all the directions of the National Green Tribunal in spite of the same being under appeal before the Supreme

The Source Apportionment Study would have established the sources of pollution in Thoothukudi. The attitude of the Tamil Nadu Pollution Control Board in not undertaking the study shows its lack of interest and it has blindly accused the company of polluting the environment, without even issuing a show-cause notice, Vedanta said

## Unacademy raises \$50 m in Series D round

Bengaluru, June 26 Learning platform Unacademy has closed a \$50-million Series D funding round from Steadview Capital, Sequoia India, Nexus Venture Partners and Blume Ventures.

Aakrit Vaish (co-founder and CEO, Haptik) and Sujeet Kumar (co-founder and CEO, Udaan) also participated in the round, along with Unacademy founders, Gaurav Munjal and Roman Saini. With this round, Unacademy has raised a total of \$88.6 million to date.

"We are seeing an unprecedented growth and engagement from learners in smaller towns and cities, and are also very humbled to see that top-quality educators are choosing Unacademy as their primary platform to reach out to students. The funds will be used to onboard more educators, fuel growth across multiple exam



Unacademy has 13 million registered learners ізтоскрното

categories and build a worldclass product and team," said Gaurav Munjal, co-founder and CEO, Unacademy.

Unacademy recently launched its Plus Subscription, which now has more than 50,000 learners.

The Plus Subscription is available for more than 20 exam categories and provides students unlimited access to live courses conducted by top educators across the country. Learners get a personalised live learning experience that is augmented by

doubt-clearing sessions with the educators, interactive classes and live test series. More than 600 live classes are conducted

every day by the educators, who teach from all across the country. Founded by Gaurav Munjal, Roman Saini and Hemesh Singh in 2015, Unacademy started as a YouTube channel by Munjal in 2010. The platform currently has

over 10,000 registered educators and 13 million learners. The start-up had previously raised a Series C round of \$21 million in July 2018 from Sequoia India, SAIF Partners, Nexus Venture Partners, and others.

"We are excited to partner with Unacademy in their journey to become the leading education company in India. The company is solving for a big consumer need by enabling millions of students and test prep takers to get access to the best educators in the country," said Ravi Mehta. MD, Steadview Capital.

## Impresario to open 18 restaurants this fiscal

SANGEETHA CHENGAPPA

Bengaluru, June 26 Impresario Entertainment & Hospitality plans to open 18 restaurants this fiscal with an investment of ₹60 crore.

The L Catterton Asia-backed hospitality major which operates in 15 cities pan-India under its eight restaurant brands including Social and Smoke House Deli, plans to hire 1,500 people to support its expan-

"We aim to open 18 new outlets in FY20 with an investment of ₹60 crore. We exited FY19 with an annual topline of ₹350 crore and are on track to consolidated turnover of ₹450 crore this fiscal, driven largely by Social," Riyaaz Amlani, CEO and MD of Impresario Entertainment & Hospitality Pvt Ltd, told BusinessLine.

"We already have 23 Social outlets in Mumbai, Delhi,

Bengaluru, Chandigarh and Pune, and are adding 12 more this fiscal in three more cities -Hyderabad, Chennai and Kolk-

Last week, the company launched a new version of its popular 10-year-old brand Smoke House Deli in Bengaluru, with the next one scheduled to come up in Hyderabad.

Amlani says the return on investment for most of the outlets is under two years. "This is possible because when we launch any of our brands in a city, we make it relevant to the hyperlocal community; more so with Social, which is a community space to hang out outside of the home and office. While most restaurants do one table-turnaround for lunch and two tableturnarounds for dinner, we do seven table turnarounds since we start with breakfast and go

time," he said.

ata." he said.

right up to the legal closing

# 'Lower logistics cost is integral to ease of doing business'

MAMUNI DAS

Asserting that FedEx is optimistic about India's potential, Rajesh Subramaniam, the company's

newly appointed President and COO, said in an interaction with BusinessLine that recent developments

like the implementation of the GST and its progress will stand the country in good stead and push the costs down. Excerpts:

This is your first visit to the country in your new capacity, and at the same time, the BJP government has entered its second term. What do you expect from the government in terms of your business and the global trade?

We are optimistic about India's potential. One of the things that the Indian government is focussing on is the ease of doing business. I think those numbers [in terms of different parameters]

have gone up significantly in the last year, and the expectation is that they will get better going forward. The other hope is that manufacturing, as a component of the total Indian economy, will

continue to rise. One of the things I do want to point out here is that for both ease of doing business and manufacturing to grow, logistics is very

important. As the right progressive policies are put in place, there is a very good chance that the cost of logistics will come down, boosting efficiency and manufacturing and improving the ease of doing business. That will be a

win-win situation for everybody.

As the industrial sector grows, there will be a need for very sophisticated movement of industrial goods through the Indian geography. One of the things that has happened in the last couple of years is the implementation of the GST. We already know it has streamlined some

traffic within India.

As that progresses, it can only serve the country better, so that the costs go down. Not only efficiency and costs, (even) manufacturing processes could get

The government has a liberalised policy as far as airports are concerned. Is that something that excites you?

We always look into these kinds of things. I am happy that the policy is in place. We will look at what options it gives us going forward. We have a terrific network in India with 23 flights a week. We operate from three gateways - Delhi, Mumbai and Bengaluru.

You are not looking at Chennai, which also has a huge industry...

Bengaluru is our South gateway, and it is a hop, skip and jump to bring traffic by road to the airport. The way we design our network is, as the volume grows, we



We have a portfolio of services in India, which is very robust. It is a matter of growing them as the business grows here RAJESH SUBRAMANIAM President and COO, FedEx Corporation

establish a beach-head to the point where we need more capacity, and then we can bifurcate and go to other destinations. We will make those kinds of

calls as opportunities arise. But right now, I think we are the only ones to operate out of three different gateways and have 23 weekly flights.

### How do you see yourself growing in the Indian market. Will it be through acquisitions or a different model? We have a portfolio of services in

India, which is very robust. It is a matter of growing them as the business grows here.

Have you seen a change in the route, depth or volume of trade, in terms of it being less via flights and more by land?

If you look at 2018, the air cargo growth was slower than in 2017, but it was still growing. If you look at overall trends for the last 30-40 years, the equation is the

When there has been GDP growth, the trade has grown faster than the GDP, air cargo has grown faster than trade, and air express — which represents the high value goods of the economy - has grown faster than air

cargo. There is a continuing telescopic relationship, because the high-value sector of the global

economy has grown and is crossing borders at a faster rate. That relationship has not fundamentally changed over the years.

How does a chemical engineer run a global logistics company?

One of the things FedEx is very much into is the use of data analytics and (having) a strategic way of thinking. When I look back at the education and training I received in IIT-Mumbai, the core tenets of having a framework to think strategically were laid there.

### How are you implementing what you learnt then in this business?

It is more about using core skills. Once I went into business, I chose to think analytically as to the market forces on which we should focus. Strategically, we must look at what areas need to be driven, what are the portfolio gaps... this was grounded in the

39%

49%

59%

## Recko gets \$1-m + seed funding from Prime **Venture Partners**

New Delhi, June 26

Recko, a fintech start-up, has raised \$1-million seed funding

from Prime Venture Partners.

Founded in 2017 by serial entrepreneurs Saurya Prakash Sinha and Prashant Borde, Recko has built a SaaS-based reconciliation product that keeps track of the complete transaction lifecycle and commercial contracts

organisations. With this investment, Prime Venture Partners has invested in eight start-ups in the fintech

sector. In the 12 months since launch, Recko has reconciled transactions worth \$2 billion and is looking to scale this by 10x in the next year. Its early customers include Grofers, Meesho and some top marketplaces across different industry

## Tracking cash flow

sectors.

With the sudden surge in digital transactions, enterprises, banks and financial institutions are finding it difficult to keep a track of the money flowing across the organisation.


There is a dire need for an independent third-party transaction reconciliation layer to ensure timely settlements among

various interacting parties. The reconciliation layer will ensure that the businesses are receiving settlements in accordance with the agreed rate cards, payout cycles, and are able to track and report payment realisation, refunds and chargebacks.

## First-hand experience

Sanjay Swamy, Managing Partner, Prime Venture Partners, said: "We invested in Recko because of the team's first-hand experience in addressing a huge problem that every company has and one that will grow by orders of magnitude with digitisation."

Reconciliation can only be solved by a neutral third-party and has traditionally been handled via spreadsheets and a battery of analysts. "Recko's tech and AI-driven approach have been very well accepted in the industry. We're delighted to see the progress," he said.



Further details in this regard can be seen at (http://govtprocurement.delhi.gov.in)

Date: June 27, 2019

### S.No Last date /time for ough e-procurei 38,62,628/-77,500/ at 3:00 PM mm dia Trunk Sewer from I.D. No. Nangloi SPS camp no. 03 to Arvind Enclave X-ing at 2019\_DJB\_174989\_1 Rohtak Road in Mundka AC-08 under EE(West)III [(Re-invite) EX. ENGINEER (WEST)-III

HINDUSTAN OIL EXPLORATION COMPANY LIMITED

Registered Office: 'HOEC House', Tandalja Road, Off Old Padra Road, Vadodara-390 020. Website: www.hoec.com Email: hoecshare@hoec.com CIN: L11100GJ1996PLC029880

Pursuant to the Securities and Exchange Board of India (SEBI) Circular No. SEBI/HO/MIRSD/DOS3/CIR/P/2018/139 dated 06-11-2018, Notice is hereby given that the following Equity Share Certificate(s) of the Company were lodged by the Transferee for transfer of Shares contained therein in their respective name(s). Share No. of Transferor's Name Folio No. Distinctive Nos. Transferee's Name 0089427 Kiran Parekh 78570837 to 78570979 344189 143 Bipin Lalji Gokani Ramniklal N Doshi 35279 9460051 to 9460150 Krishna Swamy Mohan 100 0063270 Hashmukhgauri B Trivedi 10384751 to 10384850 44526 100 Krishna Swamy Mohan 0927504 Shanti Devi Agarwa 342901 65101483 to 65101588 106 Sheela Agarwal 345112 92905667 to 92905755 89 L Ashok Kumar 0041580 Krishnan G A 170872 19956061 to 19956160 100 19956161 to 1995617 10 170874 19956171 to 1995617 11262551 to 1126265 0088777 Manoi Jair 242657 24216553 to 24216652 100 Panmal Sethia 24216653 to 24216662 24216663 to 24216667 242659 58882766 to 58882849 41770 10109151 to 10109250 100 56579 11590051 to 11590150 0092840 Kishore Lal Agrawal Any person(s) having a claim in respect of the said Certificate(s) mentioned above, should immediately send full details with documentary evidence of the claim to the Company so as to reach the Company within thirty (30) days from the date of publication of this Notice, failing which, the Company will proceed for transfer of above referred shares in favor of Transferee, as the case may be, without further information. A published copy of this Notice is being posted on Company's website at

TTK PRESTIGE LIMITED

For Hindustan Oil Exploration Company Limited

G. Josephin Daisy

Company Secretary

Corporate Office: 11 th Floor, Brigade Towers, 135, Brigade Road, Bangalore – 560 025 Registered Office: Plot No.38, SIPCOT Industrial Complex, Hosur – 635 126, TamilNadu Website: www.ttkprestige.com E-mail: investorhelp@ttkprestige.com Tel: 91 04344 276544 CIN: L85110TZ1955PLC015049

NOTICE

Notice is hereby given that pursuant to SEBI Circular SEBI/HO/MIRSD/DOS3/CIR/P/2018/139 dated 6th November 2018, a request has been received by the Company from Name of Proposed Transferee Mr. Ashok Somani, residing at Sham Kunj, 4th Floor, 30/2, C.I.T Road, Scheme –VI-M Koltaka – 700054, West Bengal to transfer the below mentioned securities held in the name of the security holder as detailed below, to his name. These securities were claimed to have been purchased by him and could not be transferred in his favour.

I	Folio No.	name of the Holder and Registered Address	and face value		From - To			
	TTK019756	Mr. Surgeonraj # 457, Main Bazaar,Vellore, TN-632004	Equity Rs. 10/- each	100	0010150585 <b>–</b> 0010150684			
I		erson who has a claim in respect of the above mentioned securities, should lodge such claim with the						

Company at its Registered Office within 30 days from this date along with appropriate documentary evidence thereof in support of such claim, else the Company will proceed to transfer the securities in favour of Mr. Ashok Somani, without any further intimation. For TTK Prestige Limited Place: Bangalore K. Shankaran Date: 26.06.2019



Cover price ₹75

Mailing Address: \_\_

Branch:

Periodicity	No. of Issues	Rate @ Cover Price(Rs.)	Free Gift	Subscrption (Without C
6 months	13	975	Wildcraft Sling Bag	599
1 Year	26	1950	A. Wildcraft Laptop Bag (or) B. AT Back Pack	999
2 Years	52	3900	A. Wildcraft Duffle Bag (or) B. Adidas Gym Bag	1599
Overseas	26	90 USD	NA	NA

To subscribe online, visit www.thehindugroup.in/subscribe.

JBSCRIPTION	ORDER FORM	

O New Subscription O Renewal (Subscription No.

For subscription, please fill the form, sign and send it to Circulation Department, The Hindu, Kasturi Buildings, 859 & 860, Anna Salai, Chennai - 600 002. E-mail: customercare@thehindu.co.in Toll-Free No.: 1800 3000 1878

			•
Pin:	District:	Sta	te:
Landline:	Mobile:	e-mail	l:
I am remitting ₹		for	6 months  for 1 Year  for 2 Years
Gift Selected: For 6 months	☐   <b>For 1 Year</b> ☐ A (or) ☐ B	For 2 Years	□В
I am opting the subscription o	ffer without Gift		
By ODD/Cheque Number	- in favour of THG Publish	ing Private Limited.,	(Add ₹10 for non-Chennai cheque)
DD/Cheque Number:		Amount: ₹	Date:
Bank:			

Signature with date:



## વર્ષ ૨૦૧૮-૧૯માં ગુજરાતમાં પાન કાર્ડ ધારકોની સંખ્યામાં ૧૧%નો વધારો

કેન્દ્રીય નાણામંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર



ન્યુ દિલ્હી,તા.૨૬ ગુજરાતમાં પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) ધારકોની સંખ્યા નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૨,૩૧,૬૬,૬૩૨ હતી જે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ર,પ૭,૧૮,૩૧૯ થઈ હતી, જે પાછલા વર્ષની સરખામણીએ ૧૧ ટકાનો વધારો દર્શાવે છે. જો , ઇન્કમ ટેક્સ રીટર્ન ભરનારની સંખ્યા ૭.૫ ટકાના ઘટાડા સાથે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૭૧,૪૧,૨૫૦ હતી જે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દદ,૦૫,૨૩૧ થઈ. કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આ માહિતી જૂન ૨૫.૨૦૧૯ના રોજ રાજ્યસભામાં ૨૫,૨૦૧૯ના રોજ રાજ્યસભ સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પછેલા પ્રશ્નના ઉત્તરમાં ઉપલબ્ધ

ગુજરાતમાંથી સીધા કરવેરાની ગુજરાતનાવા સાધા કરવરાની આવક પાછલા ના.વ.૨૦૧૮-૧૯માં ૯.૩ ટકા વધી હતી, એમ મંત્રીશ્રીએ સદનમાં રજૂ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. ગુજરાતમાંથી સીધા કરવેરાની

ના.વ.૨૦૧૬-૧૭માં રૂ.૪૪,૮૬૬.૨૭ કરોડ હતી રૂ. ૪૪,૮૬૬.૨૦ ક્યાર જે ના.વ.૨૦૧૮-૧૯માં રૂ. ૪૯,૦૨૧.૬૯ કરોડ થઈ હતી, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. મંત્રીશ્રીના નિવેદન

મતાત્રાના ાનવદન અનુસાર, ગુજરાતમાં પાન ધારકોની સંખ્યા ના.વ.૨૦૧૬-૧૭માં ૨,૦૦,૫૮,૨૩૨ હતી, જે ના.વ.૨૦૧૭-૧૮માં ર,૩૧,૬૬,૬૩૨ થઈ હતી, તેની સામે ઇન્કમ ટેક્સ રીટર્ન ભરનારની સંખ્યા ના.વ.૨૦૧૬-પ૭,૬૧,૪૮૫ થી ના.વ.૨૦૧૭-૧૮માં ૭૧.૪૧.૨૫૦ થઈ હતી.

૭૧,૪૧,૨૫૦ થઇ હતા. શ્રી નથવાણી ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં નોંધાયેલા પાન ધારકો, ભરવામાં આવેલા ઇન્ક્રમ ટેક્સ રીટર્ન, વસૂલવામાં આવેલા આવક વેરાની રકમ તથા હાથ ધરાવામાં આવેલી સર્ચ અને સીઝરની સંખ્યા

મંત્રીશ્રીએ એમ પણ જણ હતું કે છેલ્લાં ત્રણ નાણાંકીય વર્ષમાં અનુક્રમે ૨૫,૨૯૧, ૨૬,૮૦૭ અને ૨૯,૦૮૫ પૂર્મેનન્ટ્ એકાઉન્ટ નંબરો ચકાસણી માટે આવરી ત્રણ નાણાંકીય વર્ષમાં અનુક્રમે ૭૯,૨૯ અને ૩૧ ગ્રૂપ સર્ચ હાથ ધરવામાં આવી હતી, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ એમ્ પણ જણાવ્યું

હતું કે, આવકવેરા કાનૂન, ૧૯૬૧ અન્વયે સર્ચ અને સીઝર પછી તપાસ કરવામાં આવે છે જે એસેસમેન્ટમાં પરિણમે છે. કરદાતા દ્વારા આ પ્રકારના એસેસમેન્ટ સામે અપીલ કરી શકાય છે, જેને હાઇકોર્ટ/સપ્રીમકોર્ટ દ્વારા અંતિમ હાઇકાટાં સુપ્રામકાદ કારા આતમ કૃપ આપવામાં આવે છે. તપાસના પરિમાણને ત્યારે જ જાણી શકાય જ્યારે અપીલોને અંતિમ રૂપ આપવામાં આવે. જેને ધ્યાનમાં રાખતા, જ્યાં સુધી અર્ધ-ત્યાયિક અને ન્યાયિક પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સર્ચનું પરિમાણ જાણી શકાય નહીં, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

## ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનો હેતુ ઇલેક્ટ્રિક વાહનો માટે ઘણી મોટી ટ્રેક્સ રાહતો જાહેર થઇ શકે છે ઇલેક્ટ્રિક વાહનો ઉપર જીએસટીને વધુ ઘટાડી દેવા પ્રચાસ

નવી દિલ્હી,તા. ૨૬ નાણામંત્રી નિર્મલા સીતારામન દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને દરામાં ઇલકાટ્રક વાહનાન પ્રોત્સાહન આપવાના હેતુસર શ્રેજ્ઞીબદ્ધ નવી જાહેરાત કરી શકે છે. પાચમી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર બજેટમાં ખરીદદારો માટે ટેક્સ રાહતોને વધારીને આગળ વધવા મોદી સરકાર ઇચ્છુક છે. સાથે સાથ

સરકાર ઇચ્છુક છે. સાથે સાથે સરકાર ઇલેકિટ્રિકવાહનો ઉપર જીએસટીને ઘટાડવાની પણ ઇચ્છા ધરાવે છે. નજીકના સુત્રોએ કહ્યું છે કે, બ્રહેર ઉપયોગ માટે ૧૦૦ ટકા વિજળીના વાહનો લાવવાની ઇચ્છા સરકારની રહેલી છે. આ દિશામાં પહેલ કરીને ઇલેક્ટીક

મુંબઈ, તા. ૨૬ પાંચમી જુલાઈના દિવસે રજૂ કરવામાં આવનાર સામાન્ય બજેટમાં આ વખતે હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપીને અ્થંતંત્રની ગતિને તીવ્ર બનાવવાના

પ્રયાસ કરવામાં આવશે. આના ભાગરુપે વધુ ટેક્સ લાભ આપવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે, બીજા

આવાસ માટે લાભ પણ ફરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. નોકરીની વધુ તકો ઉભી કરવાના ઇરાદા

ઇલેક્ટીક વાહનો આવી જાય તે માટે પણ ટાર્ગેટ સરકાર ધરાવે છે. જુલાઇમાં રજૂ કરવામાં આવનાર નવી સરકારના પ્રથમ બજેટમાં ઇલેક્ટ્રીક ઉપયોગ માટે શ્રેણીબદ્ધ ટેક્સ રાહતો જાહેર થશે. આને લઇને વાતચીતનો દોર ચાલી રહ્યો છે. ઇલેક્ટ્રીક વાહનો ઉપર જીએસટીને વધુ ઘટાડી શકાય છે. ઇલેક્ટ્રીક વાહનોની ખરીદી કરનાર લોકોને ઇન્કમટેક્સમાં પણ રાહત આપવામાં આવશે. સરકાર પાસે અન્ય કેટલાક વિકલ્પો પણ રહેલા છે. આ બજેટ

મારકતે ખરીદદારોને ટેક્સ રાહતો

કરાયેલા ડ્રાફ્ટ એનઆરસીમાંથી ૪૦ લાખ

લોકોના નામ કમી કરવામાં આવ્યા હતા જે પૈકી

પણ કાઢી લીધી હતી. એ પછી પણ કોર્પોરેશનની

ટીમે પોતાની કામગીરી ચાલુ રાખતા ધારાસભ્ય ભડકુંચા હતા. કૈલાસ વિજયવર્ગીયે બેટ વડે

મારૂ જુનુ નામ

જૈમીનકુમાર ચંન્દ્રકાંત પટેલ

હતું બદલીને જૈમીન ચંન્દ્રકાંત

પટેલ કરેલ છે.

એ/૩७७, સૌરભ પાર્ક,

સુભાનપુરા, વડોદરા.

ભાજપ નેતા...

વાહનો માટે ટેક્સ રાહતો બજેટમાં આપવામાં આવી રહી છે ત્યારે જાહેર થઇ શકે છે. ૨૦૩૦ સુધી જીએસટી કાઉન્સિલની મંજુરીની અંગત વપરાશ માટે ૪૦ ટકા જીએસટી રેટને ઘટાડવા માટે રહેશે નહીં. આ જાહેરાતોના લીધે જીએસટીનો વિરોધ કરી રહેલા લોકોને રાહત મળી શકે છે. હજુ સુધી દેશમાં ઇલેક્ટ્રીક વાહનોનું વેચાણુ એક ટકા પણ થયું નથી. કોમર્શિયલ વાહનો કામાશયલ વાહના સાહત વાહનોના કુલ વેચાણમાં ઇલેક્ટ્રીક વાહનોનું વેચાણ એક ટકા સુધી રહ્યું નથી ત્યારે મોદી સરકાર બજેટમાં આને લઇને નવી પહેલ કરી શકે છે. બજેટને લઇને જુદા જુદા વિભાગો દારા પોત પોત રજૂઆત કરવામાં આવી રહી છે. આવી સ્થિતીમાં તમામની બાબતો પર વિચારણા જારી છે.

બજેટમાં હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા પગલાંઓ સાથે તથા અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે આ દિશામાં પહેલ કરવામાં આવનાર છે. પોપાય તેવા આવાસ માટે

હળવા વ્યાજદર, ખરીદીને પ્રોત્સાહન આપવા સહિતના વધુ પગલા લેવામાં આવનાર છે. સાથે સાથે બીજા આવાસની ખરીદી કરવા ઇચ્છુક લોકો માટે પણ કેટલાક પગલા લેવામાં આવી શકે છે. જાણકાર નિપ્ણાતોનું કહેવું છે કે, આવાસ લોન ઉપર ઉંચા ડિડક્શન વ્યાજને લઇને પણ ચર્ચા ચાલી રહી છે. મોડી રાત્રે આ મામલો બીચકતાં સોસાયટીના વહીવટકર્તા તન્મય તંબોળીને વિદેશી ચાર યુવાનોએ માર માર્યો હતો. જેમાં એક વિદેશી યુવાને તન્મૂયના માથામાં પથ્થર મારી માથું

ફાડી નાખ્યું હતું. લોહીલુહાણ થઈ ગયેલા યુવાનને તરત જ ખાનગી હોસ્પિટ્લમાં લઈ જવામાં આવ્યો હતો. બીજી બાજુ આ બનાવ બનતાં જ સોસાયટીના રહીશો ભેગા થઈ ગયા હતા અને સોસાયટીમાં રહેતા વિદેશી યુવાનોને તાત્કાલિક મકાનો ખાલી કરાવવા રહીશોએ માગ કરી હતી. મોડી રાત્રે બનેલા આ બનાવ અને ઈજાગ્રસ્ત તન્મય તંબોળીએ તાલુકા પોલીસ મથકમાં હુમલો કરનાર તમામ ચાર યુવાનો સામે કરિયાદ નોંધાવતાં પોલીસે ચાર વિદેશી યુવાનો સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી કાયદેસર

કાર્યવાહી હાથ ધરી હતી. મોડી રાત્રિએ સોસાયટીમાં આતંક મચાવનાર ચાર આફ્રિકન વિદ્યાર્થીઓના વર્તન અંગે રજૂઆત માટે શ્યામલ ગ્રીન સોસાયટીના રહીશો જેમાં મહિલાઓ પણ મોટી યામાં સામેલ હતી. એમને તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓને નિગ્રો વિદ્યાર્થીઓની હેરાનગતિ બંધ ાવવા માટે વિનંતી કરી હતી.

આફ્રિકન...

વગાડી ડાન્સ કરતા હોવાથી ાસપાસના રહીશોની ઊંઘ હરામ થાય છે. વિદ્યાર્થિનીઓ પણ મોટી સંખ્યામાં હોવાથી એ લોકો જાહેરમાં ટૂંકા વસ્ત્રો પહેરી એકબીજાને આલિંગન કે ચુંબન કરતાં હોવાથી

આસપાસ રહેતા લોકો શરમની લાગણી અનુભવે છે અને બાળક ઉપર ખરાબ સંસ્કાર ન પડે એ માટે પોતાના ઘરનાં બારણાં બંધ રાખતા હોવાની રજૂઆત રહીશોએ પોલીસને કરી છે.

૪૦ કરોડ...

દેતાં હાલમાં આ ત્રણેય આરોપીઓ જેલમાં છે ત્યારે જીએસટી વિભાગે તેઓની પૂછપરછ કરીને રૂા.૪૦ કરોડની ટેકસચોરીનની તપાસ કરવા બાબતે ચીફ કોર્ટ પાસે મંજૂરી માગી હતી ચીક કોર્ટે જીએસટી વિભાગને પછપરછ કરવા માટેની મંજરી આપી

ભણીયારા...

હતા. જ્યા તપાસ કરતા નજીકમાં વડોદરા પાસીંગના વાહનની નંબર પ્લેટ મળી આવી હતી. જેથી રાત્રીના સમયે રોડ ક્રોસ કરીત વખતે દિપડો આ ગાડીની અડકેટે આવી જતા તેનુ મોત નિપજ્ય હોંવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જોકે, અનેક વખત દિપડા શિકારની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોંય છે. તેમાય હાલોલ, વાધોડિયા તાલુકામાં અનેક વખત દિપડાએ દેખા દિધી છે. ત્યારે અંદાજે ૪ થી પ વર્ષનો આ દિપડો શિકારની શોધમાં વર્ષના આ દિવડા ક્ષાકારના શાવના આવ્યો હોંવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.વન વિભાગે દિપડાના મૃતદેહનુ પોસ્ટમાર્ટ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.દિપડાને હાથ ધરી છે.દિપડાને વાહનની ટક્કરે માથાના ભાગમાં ઈજા થતા ધટના સ્થળેજ મોત નિપજ્યુ હોંવાની વિગતો પ્રાથમિક તબક્કે પ્રકાશમાં

પહેલા પાનનું અનુસંઘાન ભાગેડં સાંડેસરાની... વા માટે કરાતો હતો. જેના થકી નાણાંની અન્ય દેશોમાં વાળવામાં આવતા હતા. આથી પટેલ સામે બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યું હતું. સીબીઆઈ દ્વારા વર્ષ ૨૦૧૭માં સ્ટર્લિંગ હતું. સીબીઆઈ દ્વારા વર્ષ ૨૦૧૭માં સ્ટર્લિંગ બાયોટેક લિ. દ્વારા બેન્ક સાથે કરવામાં આવેલી છેતરપિંડીના સંદર્ભમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટર્લિંગની ગ્રૂપ કંપનીઓ, તેના દિરેક્ટરો અને અન્યોનો . માવેશ આ એકઆઈઆરમાં કરાયો હતો. જે સ્ટર્લિંગ બાયોટેક લિ. ગ્રૂપને નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા દ્વારા પ્રમોટ કરાયું હતું. જેઓ ભારતમાં છેતરપિંડી કેસની કાર્યવાહીથી બચવા માટે વિદેશ ફરાર થઈ ગયા હતા. એન્ફોસર્મેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા આ વિદેશ કરાર થયેલા સાંડેસરા પરિવાર સામે વિશેષ મનીલોન્ડરિંગ એક્ટ કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ કાઢવામાં આવ્યું છે. એજન્સી દ્વારા અગાઉ દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ ગગન ધવન અને આંધ્ર બેન્કના પૂર્વ ડિરેક્ટર અનુપ ગર્ગ સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એન્ફ્રોસર્મેન્ટ ડિરેકટોરેટ (ઈડી) દ્વારા ગત વર્ષના મે માસમાં સાંડેસરા બંધુઓ અને તેમની કંપનીઓની કુલ રા.૪૭૦૦ કરોડની મિલકતો કબજે કરવામાં આવી હતી. આ કબજે કરાયેલી મિલકતોમાં અંદાજે ૪૦૦૦ કરોડ રૂપિયાની જમીન સહિતની સંપત્તિઓ તેમજ કંપનીના પ્લાન્ટની મશીનરીઓ, અંદાજે ૨૦૦ જેટલા વિવિધ કંપનીઓના બેન્કના ખાતાઓ અને કંપનીના પ્રમોટર્સના બેન્ક ખાતાઓ ઉપરાંત કંપનીના રા.દ. દ૭ કરોડના શેર અને કેટલીક લક્ઝુરિયસ કારનો સમાવેશ થાય છે. એન્ફોસર્મેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસમાં એવી અંગાસન કાંગ્રેક્ટાસ્ટ (ઇડા)માં તેવાસના અવો ચોંકાવનારી હકીકતમાં પ્રકાશમાં આવી હતી કે, સાંડેસરા બંધુઓ દ્વારા પ્રમોટ કરાયેલી કંપનીઓના ખોટા અને ઊભા કરેલા દસ્તાવેજોના આધારે વિવિધ બેન્કોમાંથી ૫૦૦૦ કરોડ ઉપરાંતની લોનો લેવામાં આવી હતી. જે લોનો ભરપાઈ ન થતાં અંતે કંપનીનું ખાતું એનપીએમાં ધકેલાઈ ગયું હતું. આ લોન આપનાર બેન્કોમાં આંધ્ર બેન્ક, યુકો બેન્ક, સ્ટેટ બેન્ક, અલહાબાદ બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા અને અન્ય બેન્કોનો સમાવેશ થાય છે. આ ત્રેન્કો દ્વારા આજની તારીખે સ્ટર્લિંગ ગ્રૂપ અને તેના પ્રમોટર્સ સામે છેતરપિંડી કરાઈ હોવાનં જણાયં છે. સ્ટર્લિંગ ગ્રૂપની વિવિધ કંપનીઓ દ્વારા વિવિધ બેન્કો પાસેથી ૫૦૦૦ કરોડ જેટલી લોનો ખોટા અને ઊભા કરેલા દસ્તાવેજોને આધારે લેવામાં આવી હતી, જેમાં સ્ટર્લિંગ ગ્રૂપની કંપનીઓમાં સ્ટર્લિંગ બાયોટેક લિ., સ્ટર્લિંગ પોર્ટ લિ., પીએમટી મશીન્સ લિ.. સ્ટર્લિંગ સેઝ એન્ડ ઈન્કાસ્ટકચર લિ. તથા સ્ટલિંગ ઓઈલ રિસોર્સિસ લિ.નો સમાવેશ થાય છે. સાંડેસરા બંધુઓ દ્વારા ભારતમાં અને વિદેશમાં ૩૦૦ જેટલી બેનામી અને કાગળ પર જ બોલતી કંપનીઓ ઊભી કરવામાં આવી હતી. જેના દ્વારા બેન્કો પાસેથી લીધેલી કરોડોની લોનોને બીજે ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી. આ પ્રમાણે બેન્કો પાસેથી લીધેલી લોનોની જંગી રકમનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. નાણાંની હેરાફેરી કરવા માટે સાંડેસરા બંધુઓએ ઊભી કરેલી કંપનીઓની જાળનો ઉપયોગ કરીને ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. તેઓ અલગ અલગ

બતાવીને વધુ બેન્કો પાસેથી લોનો મેળવતા હતા. લોનના નાણાંને અનેક વખત ફેરવવામાં આવત . જે ફેરવવાનું કામ કાગળ પરની અને બેનામી

કંપનીઓ થકી કરાતું હતું. હાલમાં બેન્કો સાથે થયેલી છેતરપિંડીમાં વ્યાજ સાથેની ૨કમ રા.૮૧૦૦ કરોડ સુધી પહોંચી ગઇ છે, એન્કોસમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા દેશમાંથી વિદેશમાં વિવિધ ટ્રાન્ઝેક્શનો થકી સાંડેસરા ગ્રૂપ દ્વારા મોકલાયેલા નાણાંની તપાસ જારી છે. સાંડેસરાના વિવિધ દેશોમાં વ્યવસાયી સ્થાનો આવેલા છે જેમાં મોરેશિયસ, યુએઈ, નાઈઝિરીયા, બ્રિટિશ વર્જિનઆઈલેન્ડ, સેચલેસ અને અમેરિકાનો સમાવેશ અન્ય દેશો સાથે થાય છે. એન્કોસર્મેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કરાયેલી તપાસમાં સાંડેસરા ગ્રૂપની વિદેશની ઘણી બધી માહિતીઓ એકત્ર કરવામાં આવી છે. જેમાં વિદેશમાં આવેલા ૫૦ જેટલા બેન્ક એકાઉન્ટ અને બીજી અન્ય મિલકતોનો સમાવેશ થાય છે.

રકમ પહોંચાડવામાં આવી હતી. તેમાં

રક્ય વહાવાડાના આવા હતા. ૧મા અહેમદ પટેલ પુત્ર ફેઝલ અને તેઓના જમાઈનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઈડી, સીબીઆઈની તપાસમાં આ બાબત અત્યંત મહત્ત્વની બની ગઈ છે. ખાબત અત્યંત મહત્વના બંના ગઇ છે. આ ઉપરાંત સાંડેસરા બંધુઓને ત્યાંથી તપાસ દરમિયાન એક ડાયરી મળી આવી હતી જેમાં વારંવાર એપી એટલે અહેમદ પટેલના નામનો ઉલ્લેખ હતો. નદ્ઉપરાંત વડોદરાના પોલીસ કમિશનર પદે રહી ચૂકેલા રાકેશ અસ્થાનાના નામનો પણ ઉલ્લેખ જોવા મળ્યો હતો. રાકેશ અસ્થાનાના ત્યાં માંગલિક પ્રસંગે સમયે અસ્યાપા ત્યાં માંગલક પ્રસંગ સમય સાંડેસરાબંધુઓના સ્ટર્લિંગ ગ્રૂપ દ્વારા ઘણી બધી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી હતી. જે બાબત પ્રકાશમાં આવ્યા પછી

થોડાં સમય અગાઉ ગયો હતો. કોંગ્રેસમુક્ત ભારત બનાવવા માટે કોંગ્રેસયુક્ત ભાજપ બનાવી રહેલી સરકાર સાંડેસરાના કેસ થકી કોંગ્રેસમક્ત ભારત માટે અહેમદ પટેલ મુક્ત કોંગ્રેસ બનાવવાના અભિયાનમાં લાગી હોય એમ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સાંડેસરાના ખભે બંદૂક મૂકીને ઈડી અને સીબીઆઈ થકીની પટેલનો ગાળિયો વ કસાયએમ મનાયછે.

### કોંગ્રેસ અધ્યક્ષ...

કંપનીઓ સ્થાપી, બેનામી કંપનીઓ ઊભી કરીને તેની મનઘડત રીતે બેલેન્સશિટ બનાવી, ખોટું ટર્નઓવર બતાવી, આંતરિક શેર ટ્રેડિંગ કરીને આ દર્જિથી તેઓ પાર્ટી અધ્યક્ષના પદ પર બની રહે. આ પ્રાથમિક સામન હેન્દ્ર કેમ ના સિનાને નામ સમ્તેકિયા પરિકૃત રક્ષ્મ પ્રાથમિક સ્વાર્થ કર્યા કર બેઠકમાં રાહુલે કહ્યું કે તેમની જગ્યાએ બેન્કોમાંથી લીધેલી લોનોના નાણાંની મોટાપાયે હેરાફેરી કરતા હતા. આ બેનામી અને કાગળ પરની કંપનીઓનું સંપૂર્ણ સંચાલન સાંડેસરા બંધુઓ કરતા હતા જેઓ આ કંપનીના ડિરેકટર તરીકે સ્ટર્લિંગ ગ્રૂપની વિવિધ કંપનીઓના કામદારોનો ઉપયોગ કરતા હતા. જેઓને ડમી પ્રિયંકા ગાંધીના નામનો પણ પ્રસ્તાવ કરવામાં ના સાથો સાથ કોઇ બિન કોંગ્રેસીને પાર્ટી અધ્યક્ષ બનાવામાં પરંતુ કાર્યસમિતિએ હતા. બદ્યું જ નહા, બનામાં કપેનાઓ અને સ્ટર્લિંગ ગ્રૂપ ઓફ કંપનીઝમાં ખોટી ખરીદી અને વેચાણ બતાવીને લોનના નાણાંની બીજે મોકલી આપતા હતા. તેની સાથોસાથ મોઢું ટર્નઓવર રાહુલની વાત માની નહી. કોંગ્રેસ પ્રવક્તા

### કોંગ્રેસમક્ત ભારત...

BREUFS (MICH.)
અહેમદ પટેલ પર ગાળિયો વધુ મજબૂત રીતે
કસાયાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. સ્ટર્લિંગ ગ્રૂપના કેસમાં થોડાંક સમય અગાઉ સુનીલ યાદન નામના શખ્સને આક્રપાલ કરવામાં કહ્યું હતી. આ શખ્સે સીઆરપીસી મુજબ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, સાંદેસરા બંધુઓ વતી કોંગ્રેસના નેતા અને પદ પટેલના નિવાસસ્થાને મોટી

રણદીપ સુરજેવાલા એ કહ્યું રાહુલ ગાંધીને હવે એ અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ પાર્ટીમાં પોતાની પ્રમાણે જેવી રીતે ઇચ્છે તેવા સંગઠનાત્મક

બીબ ઇબ્રાહિમ રાહિમાટોલાના લંડનના બેંક ખાતામાં જમા કરાવી હતી. ભારત સર્મથક નિઝામના વંશજોનો દાવો છે કે તે રુપિયા પર તેમનો હક છે અને પાકિસ્તાનનો આ દાવો ખોટો છે. પોતાના મૃત્યુંના બે વર્ષ પહેલા ૧૯૬૫ માં નિઝામે આ પૈસા ભારતને લેખિતમાં સોંપવામાં આવે તેવી વાત કરી હતી. જયારે પાકિસ્તાન બે દાયકા પહેલા સાચવવા આપવામાં આવેલી રકમ <mark>ાર પોતાનો દાવો</mark> લગાવી રહ્યો છે.

ઠેરવવામાં આવ્યા હોય તેમને એનઆરસીમાંથી

એનઆરસી તૈયાર કરાયા બાદ નાગિરક નોંધણીના સ્થાનિક રજિસ્ટ્રાર દારા કલમ ૪(૩)ની જોગવાઈ હેઠળ ગેરલાયક ઠરાવવામાં આવેલા લોકોને પણ ડાક્ટ એનઆરસીમાંથી કરાયા છે. જુલાઈમાં તૈયાર

ભારત કે પાકિસ્તાન...

કોર્પોરેશનના કર્મચારીને ફટકારવાનુ શરૂ કર્યું હતુ. otauth of the state of the stat VADILAL SHAH to HEENABEN AVESHKUMAR SHAP C/62, Harkashi Society, Harni Road, Vadodara. જાહેર નિવિદા એસ. કે. નં. -૦૬ સને : ૨૦૧૯-૨૦

www.mcgovin આથી જાહેર જનતાને જણાવવાનું કે વકોદરા મહાનગર પાલિકાના પુર્વઝોનમાં

સમાવિષ્ટ વહીવટી વોર્ડ નં-૧.૨ અને હનાં વિસ્તારોમાં જર્યરીત મિલ્કતોને

જી.પી.એમ.સી એક્ટ-૧૯૪૯ની કલમ ૨૬૪ મુજબ નોટીસોની યાદી VMCની

ઉપર જણાવેલ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જી.પી.એમ.સી

એક્ટ **૧૯૪૯ની કલમ २**५४ मुक्ज तेमक के मिट्डतना माલिङ/लाइआतना

કોર્ટકેસ ચાલતા ફોઇ તેવી જર્જરીત મિલ્કતોમાં રહેવું અત્યંત જોખમી ફોવાથી

કોઇપણ વ્યક્તિએ રહેવું નહી કે પ્રવેશ કરવો નહી તથા જર્જરીત મિલ્કતો પાસેથી

રાહદારીઓએ પસાર થવું નહી તેમ છતાં મિલ્કતમાં પ્રવેશ કરશે અથવા

રાફદારીઓ પસાર થશે અને અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી વડોદરા

મહાનગર પાલિકાની રહેશે નહી. જે અંગે જાહેર જનતાએ નોંઘ લેવા વિનંતી છે.

પી.આર.ઓ.નં.૧૯૯/૨૦૧૯-૨૦

કામનું નામ આહવા/વધઈ પેટા વિભાગ હત્તકનાં રસ્તાઓ ઉપર ડામર પેચવર્ક/પેવર પક્ષા કરવાની કામગીરી જે ટેન્ડરના દસ્તાવેજો વેબસાઈટ <u>www.rnb.nprocure.com</u>

ઉપર તા.૦૧-૦૭-૨૦૧૯, ૧૮.૦૦ કલાક સુધી જો નિવિદા રાજ્ય સરકારની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.

(प्रथम प्रयत्न)

કાર્યપાલક ઈજનેરશ્રી ડાંગ (માડમ) વિભાગ, આહવા મેઈન રોડ આહવા ટે.નં.(૦૨૬૩૧) ૨૨૦૨૨૮ આહવાની કચેરી દ્વારા નીચે જજ્ઞાવેલ કામ માટેના ઈ-ટેન્ડરીંગ ઓન લાઈન પદ્ધતિથી આઈટમ રેટથી મંગાવવામાં આવે છે.

ટેન્ડરની વિગતવાર શરતાં ટેન્ડર સાથે મુકવામાં આવે છે. દર્શાવેલ કામગીરીના અનુભવ ધરાવતા ઈજારદારો પાસેથી ભરેલ ભાવ પત્રકો ઓન લાઈન તા.૦૧-૦૭-૨૦૧૯ના રોજ ૧૮.૦૦ કલાક સુધીમાં સ્વીકારવામાં આવશે.

(માહિતી/ડાંગ/७૩/૨૦૧૯)

ધારાસભ્યે કાયદો હાથમાં લેતા તેની ટીકા પણ થઈ રહી છે. બીજી તરફ આખો મામલો કેમેરામાં પણ

### ૩૬ લાખ લોકોએ પોતાના નામ કાઢી નાંખવા સામે દાવો કર્યો હતો. રાજ્યના કો-ઓર્ડિનેટરના જણાવ્યા મુબજ જે વધુ એક લાખ લોકોના નામ કાઢવામાં આવ્યા છે તેમને તેમના નિવાસ સ્થાને પત્ર <u>દારા કારણો</u> સહિત જાણ કરવામાં આવશે. બાલાકોટ હુમલાના...

ગોયલને પાકિસ્તાનના એક્સપર્ટ માનવામાં આવે છે. ૧૯૯૦ના દશકામાં આતંકવાદનો સામનો કરી રહેલાં પંજાબની સ્થિતિને ાળવામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તો અરવિંદ કુમારને જમ્મુ કાશ્મીરના એક્સપર્ટ માનવામાં આવે છે.

એ પછી માંડ માંડ મામલો થાળે પડ્યો હતો. જોકે

તેમના પર તેમના સચિવ કરતા પણ ઓછા દરે ટેક્સ વસૂલવામાં આવે છે. આ જૂથે કહ્યું કે, વેલ્થ

ટેક્સથી જળવાયુ સંકટનો ઉકેલ મેળવી શકાય છે. અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય વ્યવસ્થાને સુધારી શકાય છે. સાથે જ પર્યાપ્ત અવસરો પેદા કરી શકાય છે. આનાથી અમારી લોકતાંત્રિક આઝાદી

રાકાય છે. આનાથા અમારા લાકતાત્રિક આઝાદા પણ મજબૂત વધો તેલ્લ ટેક્સ લગાવવો આપણા ગણતંત્ર માટે લાબદાયક છે. <mark>જેઇનમાં અસ્થાગી!!!</mark> સીટ અને પૂર્વ યુરોપીય સુપ માટે એક સીટ આરશિત છે. જોલાકારોનું કહેવું છેકે, સામાન્ય રીતે કોઈ પણ મહત્વપૂર્ણ વિષય પર સ્થાઈ સદસ્ય દેશોની ભૂમિકા મહત્વ હોય છે. તેમને વીટો લગાવાવાનો અધિકાર હોય છે. જ્યારે અસ્થાઈ સદસ્ય દેશોને પોતાનું મંતવ્ય રાખવાનો અધિકાર

## હિન્દુસ્તાન ઓઇલ એકસ્પ્લોરેશન કંપની લિમીટેડ

રજી, ઓફિસ : 'એપઓપ્રેની ફાઉસ', તાંદળના રોક, જૂલા પાદરા રોક પાસે, વડોદરા–accozo Website: www.hocc.com Email: hoccsharo@hocc.com CIN: L11100L1986FL02988 વેમ્પ્ય એક ઓફ પ્રોક્સિયા (સેમ્પી) ના પરિપત્ર ક્યાંક રોબી એપઓ/ એમ્બામાર્પ્યસ્થેનાદી, મેં વ્યવસ્થિત વર્શીમાં દાવ ના માન્યા ભાગા હોયો આપવામાં કહે છે તે તે કે સાર્થિક

કોલીઓ નં.	ટ્રાન્સકરર્સનું નામ	શેર સદીકીકેટ મંબરો	ડીસ્ટીંકટીય નંબર્સ	શેર્સની સંખ્યા	ટાન્સકરીના નામ	
00/6846	ક્ષિશ્છા પારેખ	377760	พะพงคะลง ซีโ พะพงคงค	113	બીપીન લાલજી ગોકાની	
OTRETHE	રમણીકલાલ એન. દોશી	34996	<b>६४९००५१ थी ६४९०१५०</b>	100	કિપ્લા સ્વામી મોદલ	
0093490	કસમુખગૌરી બી. ત્રિવેદી	YYVRF	१०३८४४५१ थी १०३८४८५०	100	કિલ્લા સ્વામી મોદન	
VOPWF90	શાંતિ દેવી અગરવાલ	374601	<b>१५१०१४८३ वी १५१०१५८८</b>	105	શિલા અગરવાલ	
		374118	<b>६</b> २६०५५५७ थी <b>६२६०५७</b> ५५	€6		
0087460	કિપ્લાલ જી. એ.	100608	१६६५१०११ वी १६६५१११०	100	એલ. અશોક કુમાર	
200000000000000000000000000000000000000		100603	१६६५११११ वी १६६५११७०	10	· ·	
		100 <i>c</i> 01	१८८५११४१ दी १८८५११४५	ч		
		4330Y	าาจรจนนา ผี าาจรจรนอ	100		
0022999	भलोक्ष चैल	RYRFUD	વ૪વ૧૭૫૫૩ થી વ૪વ૧૭૭૫વ	900	પત્રમલ શેઠીઆ	
		RYRSYC	<b>२४२१</b> ५५५३ सी २४२१५५५२	10		
		4¥4546	<b>२४२१९९७३ ह्यो २४२</b> १९९७७	ч		
		377486	<b>५८८८२७७७ श्री ५८८८२८४७</b>	C¥		
		¥1000	าดาดอานา ผี าดาดอลนด	100		
0064580	કિશોર લાલ અગ્રવાલ	<b>49400</b>	11400041 @ 11400140	100	अन्तुरा लाक्ट	

ાનના હર સ્વારાક્કાર અંગ થાઇ વ્લાકાલા દાના ભૂત, તા તાફા આ લાદરા કારાવાર વધામાં તાફાર પહોંચે તે રીતે દાવાના દસ્તાવેજી પુરાવા સાથે સંપૂર્ણ વિગતો કંપનીને મોકલવી. જો અમ કરવ (પ્રકારની વધુ માફિતી આપ્યા વિના કંપની ઢાનકરીની તાસેણમાં ઉપરોક્ત સંદર્ભિત શેર્સના રહ્ય ઘશે. આ નોટિસની પ્રકાશિત કોપી કંપનીની ઈ રિક ઇલ્લે કર્કાંગ કમ્ય <u>moo.paon.www</u> કોર

હિન્દરતાન ઓઇલ એક્સ્પલોરેશન કંપની લિમીટેક વર્તી.

જી. જોરોફીન ડેઇઝી

કંપની સેકેટરી

રજિ. ઑફિસ : 'ગૃહ', નેતાજી માર્ગ,

મીઠાખળી છ રસ્તા પાસે, એલિસબ્રિજ, અમદાવાદ-૬. डोन : ६१-७६-२५४२१५७१-७५

લિમિટેડ\_ CIN: L65923GJ1986PLC008809

### સાંકેતિક કબજા અંગેની નોટિસ

ફ્રોઈનાન્સ

ઑફ સિક્યરિટી ઈન્ટરેસ્ટ એક્ટ,૨૦૦૨ની કલ ध भिड्यरिटाधीत्रेशन એन्ड रिडन्स्टडशन रु ૧૩(૧૨) દેઠળ આપવામાં આવેલી સત્તાઓ, કે જેનો અર્થ ધ સિક્યુરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ,૨૦૦૨ના નિયમ ૯માં આપવામાં આવ્યો છે, તે સત્તાઓનો ઉપયોગ કરતાં આથી નોટિસ આપવામાં આવે છે કે. અધિકૃત અધિકૃતીએ,અઠી જણાવેલાં ખાતાંઓને ડિમાન્ડ નોટિસ પાઠવી હતી અને માં તે નોટિસ મબ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર, રકમ ભરપાઈ કરી દેવા માટે જણાવ્યું હતું.

દેવાદાર આ રકમ ભરવામાં નિષ્ફળ ગયા હોવાથી,આથી દેવાદાર અને જાહેર જનાને નોટિસ આપવામાં આવે છે કે, નીચે સહી કરનાર વ્યક્તિએ,ઉપરોક્ત ધારાની કલમ ૧૩(૪) જેનો અર્થ ઉપરોક્ત ધારામાં નિયમ ૯માં આપવામાં આવ્યો છે–તે મુજબ તે વ્યક્તિ (નીચે સહી કરનાર) ને મળેલી સત્તાનો ઉપયોગ કરીને, તેણે અહીં નીચે જે મિલકતનું વર્ણન આપવામાં આવ્યું છે, તે મિલકતનો સોકેતિક કબજો લઈ લીધો છે.

નાથી, ખાસ કરીને દેવાદારને અને જાહેર જનતાને ચેતવવામાં આવે છે કે તે મિલકત અંગે કોઇપણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં અને છતાં જો તે મિલકત અંગે કોઈપણ પ્રકારનો વ્યવદાર કરવામાં આવશે તો તે અંગેની રકમ અને વ્યાજ બાબતે, ગૃદ કાઈનાન્સ લિમિટે ડને આધીન રહેશે.

સિક્યોર્ડ એસેટ રીડીમ કરવા માટે ઉપલબ્ધ સમયના સંદર્ભે કાયદાની કલમ ૧૩ની પેટા કલમ (૮) ની જોગવાઈઓ તરફ કર્જદારનું ધ્યાન દોરવામાં આવે

0.							
દેવાદારનું નામ અને લોન ખાતા નં.	મોર્ટગેજ મિલકતનું વર્ણન (સિક્યુર્ક એસેટ્સ)	કિમાન્ડ નોટિસની તારીખ	કબજા અંગેની નોટિસની તારીખ	ડીમાન્ડ નોટિસ આપેલ તારીખે બાકી રહેતી રકમ			
શ્રી નીરવ ડી. પટેલ શ્રીમતી શીતલ નીરવ પટેલ લોન ખાતા નં. 30૧/૯૩७૬	બધી જ ચલ અને અચલ આવાસીચ સંપત્તિ કે જે રેવન્થુ સર્વે નં. ૪૯૫, બ્લોક નં. ૩૫૫ પૈકી ૧, ફ્લેટ નં. ૩૦૨, ટાવર–એ, ત્રીજો માળ, વિડ્ચોર સ્કૂલની પાસે, અટલાદરા બિલ રોક, વકોદરા પર સ્થિત છે	99.02.2096	₹₹.05.₹0٩€	3I. 8,99,485.30			
ડો. અજયકિશોર એસ. મિશ્રા શ્રીમતી અંજના અજયકિશોર મિશ્રા લોન ખાતા નં. 30૧/૭૧૯૧	બધી જ ચલ અને અચલ આવાસીય સંપત્તિ કે જે રેવન્થુ સર્વે નં. ૧૮૪/૫, બી–૧૧૬, બકોર નગર સોસાચટી, ન્યૂ વીઆઈપી રોડ, સવાદ, વડોદરા પર સ્થિત છે	२८.03.२0१८	RR.05.R096	રૂા. ૩,૫૨,૩૩૧.૦૦			

ડિરેકટર બનાવીને નાણાંની હેરાફેરીનું કાર્ય કરતા હતા. એટલું જ નહીં, બેનામી કંપનીઓ અને



કાર્ચપાલક ઇજનેર( પર્વઝોન)













અધિકૃત અધિકારી ગૃહ ફાઈનાન્સ લિમિટેડ